



RAN-1905090103060002

LL.M. (Sem. - III) Examination November - 2025

Banking Law - II

Time: 3 Hours]

[Total Marks: 70

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. બેંકર અને ગ્રાહકને વ્યાખ્યાયિત કરો. બેંકર અને ગ્રાહક વચ્ચેના કરાર સંબંધની ચર્ચા કરો. (14)
અથવા
- પ્ર. 1. ભારતમાં બેંકિંગ કંપનીઓના ધિરાણ અને ધિરાણ નીતિ પર સરકાર અને તેની એજન્સીઓ દ્વારા નિયંત્રણની ચર્ચા કરો. (14)
- પ્ર. 2. મધ્યસ્થ બેંકની લાક્ષણિકતા અને કાર્યની ચર્ચા કરો. (14)
અથવા
- પ્ર. 2. બેંકિંગ નિયમન અધિનિયમ હેઠળ ભારતમાં બેંકિંગ વ્યવસાય માટે નિયમનકારી માળખાની ચર્ચા કરો. (14)
- પ્ર. 3. પરક્રમ્ય લેખોના અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત પરક્રમ્ય લેખોના પ્રકારોની ચર્ચા કરો. (14)
અથવા
- પ્ર. 3. નાબાઈના નાણાંકીય કાર્યો સમજાવો. આ કાર્યો ગ્રામીણ વિકાસમાં કેવી રીતે ફાળો આપે છે? (14)
- પ્ર. 4. IDBI અધિનિયમમાં દર્શાવેલ IDBI ના કાર્યો અને સત્તાઓની ચર્ચા કરો. તે ઉદ્યોગોને નાણાંકીય સહાય કેવી રીતે પૂરી પાડે છે? (14)
અથવા
- પ્ર. 4. વિગતવાર ચર્ચા કરો : બેંકર્સ બેંક તરીકે RBI (14)
- પ્ર. 5. ટૂંકનોંધ લખો (કોઈપણ બે) (14)
1. ધારક અને નિયત સમયે ધારક
 2. ચેકનો અનાદર
 3. બેંકિંગ કંપનીનું પુનર્નિર્માણ
 4. બેંક દર નીતિ રચના.

ENGLISH VERSION

- Q. 1.** Define banker and customer. Discuss the contractual relationship between banker and customer. (14)
- OR**
- Q. 1.** Discuss control by government and its agencies over lending and credit policy of banking companies in India (14)
- Q. 2.** Discuss the characteristic and function of central bank (14)
- OR**
- Q. 2.** Discuss the regulatory frame work for banking business in India under the banking regulation act. (14)
- Q. 3.** Discuss the types of negotiable instruments recognized under the negotiable instrument act. (14)
- OR**
- Q. 3.** Explain the financial functions of NABARD. How do these functions contribute to rural development? (14)
- Q. 4.** Discuss the functions and powers of IDBI as outlined in the IDBI act. How does it provide financial assistance to industries? (14)
- OR**
- Q. 4.** Discuss in detailed : RBI as bankers' bank (14)
- Q. 5. Write short notes (Any Two)** (14)
1. Holder and holder in due course
 2. Dishonor of Cheque
 3. Reconstruction of banking company
 4. Bank rate policy formation
-